

---

# Svarupanusandhanashtakam or Vijnananauka

---

स्वरूपानुसन्धानाष्टकम् विज्ञाननौका च

---

## Document Information

---

Text title : svarupanusandhaanaaShTaka

File name : svarupa-8.itx

Category : aShTaka, shankarAchArya, vedanta

Location : doc\_z\_misc\_shankara

Author : attributed to shankaraachaarya

Transliterated by : Sunder Hattangadi

Proofread by : Sunder Hattangadi

Description-comments : Vedanta philosophy

Latest update : March 22 2003

Send corrections to : sanskrit at cheerful dot c om

---

This text is prepared by volunteers and is to be used for personal study and research. The file is not to be copied or reposted without permission, for promotion of any website or individuals or for commercial purpose.

**Please help to maintain respect for volunteer spirit.**

---

Please note that proofreading is done using Devanagari version and other language/scripts are generated using **sanscript**.

---

February 2, 2024

*sanskritdocuments.org*

---

स्वरूपानुसन्धानाष्टकम् विज्ञाननौका य



तपोयज्ञादानादिभिः शुद्धबुद्धि-  
विरक्तो नृपाटेः पटे तुच्छबुद्ध्या ।  
परित्यज्य सर्वं यदाप्नोति तत्त्वं  
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ १ ॥

दयालुं गुरुं ब्रह्मनिष्ठं प्रशान्तं  
समाराध्य मत्या विचार्य स्वरूपम् ।  
यदाप्नोति तत्त्वं निदिध्यास विद्वान्-  
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ २ ॥

यदानन्दरूपं प्रकाशस्वरूपं  
निरस्तप्रपञ्चं परिच्छेदहीनम् ।  
अहम्ब्रह्मवृत्तैकगम्यं तुरीयं  
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ३ ॥

यदज्ञानतो भाति विश्वं समस्तं  
विनष्टं य सद्यो यदात्मप्रबोधे ।  
मनोवागतीतं विशुद्धं विमुक्तं  
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ४ ॥

निषेधे कृते नेति नेतीति वाङ्मयैः  
समाधिस्थितानां यदाभाति पूर्णम् ।  
अवस्थात्रयातीतमद्वैतमेकं  
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ५ ॥

यदानन्दलेशैः समानन्दि विश्वं  
यदाभाति सत्त्वे तदाभाति सर्वम् ।  
यदाहोऽने रूपमन्यत्समस्तं  
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ६ ॥

अनन्तं विभुं निर्विकल्पं निरीडं  
 शिवं सङ्गुडीनं यदोङ्कारगम्यम् ।  
 निराकारमत्युज्ज्वलं मृत्युडीनं  
 परं ब्रह्म नित्यं तदेवाडमस्मि ॥ ७ ॥

यदानन्द सिन्धौ निमग्नः पुमान्स्थान-  
 दविद्याविलासः समस्तप्रपञ्चः ।  
 तदा नः स्फुरत्यद्भुतं यन्निमित्तं  
 परं ब्रह्म नित्यं तदेवाडमस्मि ॥ ८ ॥

स्वरूपानुसन्धानरूपां स्तुतिं यः  
 पठेदादराद्भक्तिभावो मनुष्यः ।  
 श्रुणोतीह वा नित्यमुद्युक्तचित्तो  
 भवेद्विष्णुरत्रैव वेदप्रमाणात् ॥ ९ ॥

एति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य  
 श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य  
 श्रीमच्छङ्करभगवतः कृतौ  
 स्वरूपानुसन्धानाष्टकं सम्पूर्णम् ॥

Encoded and proofread by Sunder Hattangadi

आभाति = shines

आचार्यस्य = Teacher's

आदराद् = with respect

आदिभिः = and other deeds

आलोकने = seeing

आनन्द = bliss

आप्नोति = obtains

आत्म = soul

अद्भुतं = wondrous

अद्वैतम् = non-dual

अहम् = I

अज्ञानतो = by ignorance

अनन्त = infinite
अनुसन्धान = communion
अन्यत् = other
अष्टकम् = 8 verses
अस्मि = .. I.. am
अतीत = transcending
अत्र = here
अत्य = exceedingly
अवस्था = state
अविद्या = ignorance
भाति = shines
भावो = mood
भगवत् = endowed with Lordly powers
भक्ति = devotion
भवेद् = becomes
ब्रह्म = Spirit
ब्रह्मनिष्ठ = devoted to Truth/Spirit
बुद्धि = intellect
बुद्ध्या = . discrimination
य = and
छन्द = Shankara
चित्तो = heart
दान = donation
दयालु = compassionate
ऐक्यग्र्यं = aiming for the One
ऐकं = one alone
एव = only
एव = itself
गम्यम् = . realising
गोविन्द = Govinda
गुरु = Teacher
हीन = without

- डीन = less  
 धल = here  
 धति = thus  
 कृतौ = composed  
 कृते = having done  
 लेशैः = a fraction  
 मनो = mind  
 मनुष्यः = . human  
 मत्या = mind  
 मृत्यु = death  
 नः = to us  
 नेति = neti 'not this, not this'  
 निदिध्यास = constant contemplation  
 निमग्नः = steeped  
 निमित्तं = occasion  
 निराकारम् = formless  
 निरस्त = given to penance  
 निरीडं = desireless  
 निर्विकल्पं = beyond thought  
 निषेधे = negating  
 नित्यं = eternal  
 नृपादिः = kings and others  
 ओङ्कार = OM  
 पदे = feet  
 परं = supreme  
 परमहंस = supremely discriminating  
 परिच्छेद = separation  
 परित्यज्य = giving up  
 परिप्राजक = itinerant  
 पठेद् = studies  
 प्रबोधे = . enlightened  
 प्रकाश = illumined

प्रमाणात् = .. 9.. authority

प्रपञ्चः = . manifest world

प्रशान्ति = serene

पुमान् = human

पूज्य = worshipful

पूर्णां = . perfect

रूपां = form

सङ्ग = attachment

सधी = immediately

समाधि = deep absorption

समानन्दि = blissful

समाराध्य = tranquil

समस्त = all

समस्तं = everything

सम्पूर्णां = .. ends

सर्वं = all

सत्त्वे = in essence

शिष्यस्य = disciples

शिवं = auspicious

श्री = glorious

श्रुणोति = listens

शुद्ध = pure

सिन्धौ = ocean

स्फुरत्य् = inspires

स्थितानि = attained

स्तुतिं = praise

स्वरूप = one's essence

स्वरूपम् = . one's essential nature

स्याद् = if it be

तद् = that

तदा = then

तपो = [tapaH] austerility

तत् = that  
तत्त्वं = essence  
त्रय = three  
तुच्छ = trifling  
तुरीयं = the fourth state  
उद्युक्त = motivated  
उज्ज्वलं = bright  
वा = or  
वाग् = speech  
वाक्यैः = phrases  
वेद = Veda  
विभुं = glories  
विचार्य = asking  
विद्वान् = wise  
विलासः = play  
विमुक्तिं = liberated  
विनष्टं = vanishing  
विरक्तः = dispassionate  
विष्णुर् = all pervading  
विशुद्धं = pure  
विश्वं = world  
वृत्त्या = mental attitude  
यः = who  
यज्ञ = sacrifice  
यन् = that  
यत् = that

---

*Svarupanusandhanashtakam or Vijnananauka*  
pdf was typeset on February 2, 2024

---

Please send corrections to [sanskrit@cheerful.com](mailto:sanskrit@cheerful.com)

